

Central Zone Community Halls Booking

Hall Name *	<input type="checkbox"/> Galemandi Community Hall <input type="checkbox"/> Rustampura Community Hall <input type="checkbox"/> Salabatpura Multipurpose Hall <input type="checkbox"/> Sagarampura Community Hall (Without Kitchen)				
Program Type *	<input type="checkbox"/> Educational/ Samajik Sanskrutik Karyakram (शैक्षणिक/सामाजिक सांस्कृतिक कार्यक्रम)	<input type="checkbox"/> Religious Lectures (धार्मिक वचन)	<input type="checkbox"/> Seminars (सेमीनार)	<input type="checkbox"/> Marriage/ Reception (लग्न/स्वागत)	<input type="checkbox"/> Business Purpose (बिजनेस हेतु)
	<input type="checkbox"/> Shok-Sabha(without Food & Breakfast) - शोक सभा(फूड अन्ड ब्रेकफ़ास्ट बिना)	<input type="checkbox"/> Annual Meeting (वार्षिक मीटींग)			
Booking Date *					
Floor *	<input type="checkbox"/> Ground Floor <input type="checkbox"/> First Floor(Without Kitchen) <input type="checkbox"/> Second Floor(Without Kitchen)				
Name of Organization / Applicant *					
	(Cheque for refund of deposit if any will be issued in above name only)				
Responsible Person *					
Identity Card No. *					
TAN					
GST No.					
Address For Communication*					
City *					
State *					
Email ID *					
Phone No. *					
Mobile Number*	(1)		(2)		
Provide Bank Details for Refund Process if any					
MICR Code					
Bank Account Number					
IFSC Code					

Note:

1. For booking payment must be made in cash/DD/Credit-Debit Card/Pay Order.
2. Advance booking to be considered as 151 days or more and regular booking considered within 150 days.
3. All parties/organizers have to observe the SMC RULES.
3. Passbook Xerox compulsory with this form (for refund process).

Applicant Name & Signature